

ત્વરિત જાહેરાત માટે

પોતાનો મત દર્શાવીને બ્રેમ્પટનને એક હરિત શહેર બનાવવામાં યોગદાન આપો

અર્બન ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્લાન (શહેરી વન સંચાલન યોજના) અને પાર્કલેન્ડ ડેવલોપમેન્ટ સ્ટ્રેટેજી સર્વે (પાર્કલેન્ડ સમર્પણ રણનીતિ સર્વેક્ષણો) હવે ઓનલાઇન ઉપલબ્ધ છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (14 માર્ચ 2022) – સિટી ઓફ બ્રેમ્પટનને અર્બન ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્લાન અને પાર્કલેન્ડ ડેવલોપમેન્ટ સ્ટ્રેટેજી સર્વેનું લોકાર્પણ કર્યું છે જેથી સામુદાયિક વૃક્ષો અને ઉદ્યાનોનો વિકાસ થઈ શકે.

અર્બન ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્લાન સર્વેક્ષણ

સિટીના પ્રથમ અર્બન ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્લાન (UFMP)ના ઉપસંહારનો મુસદ્દો સમાજના પ્રતિભાવ મેળવવા તૈયાર છે.

બ્રેમ્પટનના શહેરી વનોમાં સિટીની સીમાઓની અંદર રહેલ જાહેર તેમજ ખાનગી જમીનો પર રહેલ તમામ વૃક્ષો અને તેમના વિકાસ પામતા પર્યાવરણોનો સમાવેશ થયા છે. હાલના વૃક્ષો અને વૃક્ષોના વિસ્તરતા છત્રનું રક્ષણ કરીને બ્રેમ્પટનના શહેરી વન વધારવા માટે અને જાળવવા માટેની વ્યુહાત્મક દિશા UFMP પૂરી પાડશે.

આ ઉપસંહારના મુસદ્દામાં સિટીએ એવી 36 કૃતિઓ ઓળખી કાઢી છે જેનો આધાર અત્યાર સુધી થયેલ સંશોધન, વિશ્લેષણ અને પ્રવૃત્તતા પર છે.

UFMP તે બ્રેમ્પટન ગ્રો ગ્રીન ઈન્વાયરનમેન્ટલ માસ્ટર પ્લાન (Brampton Grow Green Environmental Master Plan)નો ભાગ છે. UFMP બ્રેમ્પટન 2040 વિઝન અને કમ્યુનિટી એનર્જી એન્ડ એમિશન્સ પ્લાન (CEERP) (Community Energy and Emissions Plan (CEERP)ના 2040 સુધીમાં બ્રેમ્પટનમાં દસ લાખ વૃક્ષોની વાવણી કરવાના લક્ષ્યાંકોને પણ સંબોધિત કરે છે.

11 માર્ચ 2022 થી 01 એપ્રિલ 2022 સુધીમાં રહેવાસીઓ અને હિરસાધારકોને ઉપસંહારના મુસદ્દા પર પોતાના વિચારો ઓનલાઇન રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. સર્વેક્ષણ લેવા માટે www.brampton.ca/trees ની મુલાકાત લેશો.

પાર્કલેન્ડ ડેવલોપમેન્ટ સ્ટ્રેટેજી સર્વેક્ષણ

સિટી તેના અનેક ઉદ્યાનો અને કુદરતી વારસાની જમીનોનો વિકાસ કરવા પ્રતિબદ્ધ છે. સિટીની પાર્કલેન્ડ ડેવલોપમેન્ટ સ્ટ્રેટેજીનો હેતુ બ્રમ્પટનના વધતી જતી સમાજને વધુને વધુ હરિત જગ્યા પ્રદાન કરવાની જરૂરિયાતને સંબોધવાનો છે. આ વ્યુલરચના નવા પાર્કલેન્ડ ડેવલોપમેન્ટ ઉપનિયમને સૂચિત કરવા અને પાર્ક એન્ડ રિક્રિએશન માસ્ટર પ્લાન (Parks and Recreation Master Plan) 2017 ની ભલામણોને આગળ ધપાવવા માટે સહાય કરશે.

સમાજના પ્રતિભાવો માટે વ્યુલરચનાનો પ્રારંભિક અભ્યાસ તૈયાર છે. 11 માર્ચ 2022 થી 01 એપ્રિલ 2022 સુધીમાં રહેવાસીઓ અને હિસ્સાધારકોને અભ્યાસ પરના પોતાના વિચારો ઓનલાઇન રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. [વધુ જાણવા અને સર્વેક્ષણમાં ભાગ લેવા માટે અહીં ક્લિક કરો](#)

સુવાક્યો

"બ્રમ્પટન એક ગ્રીન શહેર છે, જે તમામ લોકો માણી શકે એવા અનેક ઉદ્યાનો અને કુદરતી ધરોહરની ભૂમિ ધરાવે છે. અમે જ્યારે પાર્કલેન્ડ ડેવલોપમેન્ટ સ્ટ્રેટેજી અને અર્બન ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્લાન વિકસાવીશું ત્યારે સિટી સુનિશ્ચિત કરતા રહેશે કે જાહેર જનતા તેમજ હિસ્સાધારકોને પ્રવૃત્ત કરવા આવે. હું બધાને આ સર્વેક્ષણોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરું છું જેથી કરીને આપણા ઉદ્યાનો અને વૃક્ષોનું સંવર્ધન થઈ શકે."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સિટી ઓફ બ્રમ્પટન

"જો તમે બ્રમ્પટનમાં બહારના વાતાવરણનો આનંદ માણતા હશો તો પાર્કલેન્ડ ડેવલોપમેન્ટ સ્ટ્રેટેજી અને અર્બન ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્લાન તમને સહાય કરશે. બ્રમ્પટન વિકસતું શહેર છે અને અમે જ્યારે ઉદ્યાનો અને વૃક્ષોની કાળજી લેવાની અમારી વ્યુલરચનાઓનો વિસ્તાર કરી રહ્યા છીએ ત્યારે અમને તમારા પ્રતિભાવની જરૂર છે. આજે જ આ ટૂંકા સર્વેક્ષણો પૂર્ણ કરો!"

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રમ્પટનના પ્રમુખ

"ઉદ્યાનો, કુદરતી ધરોહરની ભૂમિ અને વૃક્ષો આપણા સમુદાયના મહત્વપૂર્ણ ઘટકો છે. પાર્કલેન્ડ ડેવલોપમેન્ટ સ્ટ્રેટેજી અને અર્બન ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્લાન અંગે આપના પ્રતિભાવો જરૂર આપશો જ્યારે આપણે બ્રમ્પટનના ઉદ્યાનો અને વૃક્ષો માટેની આ મહત્વપૂર્ણ પહેલોથી આગળ વધી રહ્યા છીએ."

- શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) સિટી કાઉન્સિલર વોર્ડ 7 અને 8, ઉપ-પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca